

॥ तस्य वाचकः प्रणवः ॥

# ऋतमसरा

आत्मनो हिताय जगतः सुखाय



‘योग’ भिक्षा लावीओ, ‘भिक्षु’ बनी गुरुद्वार;  
मुमुक्षु जड़र पामशे, सौनो मुजमां भाग।

॥ ૩૦ ॥

॥ તસ્ય વાચક : પ્રાગવ : ॥

॥ ઈશ્વરનું નામ ઓમ્ છે ॥

- : સાચી સુખ-શાંતિ સાચી સમજણમાં રહેલા છે : -

એક પતિ-પત્ની વિદ્યુત-પંખો ખરીદીને ઘેર આવ્યા. હવે બંને વિચાર કરે છે કે પંખો કયા ખૂણામાં રાખીશું? આવી નાની શી બાબતમાં બંનેમાં એવો મતભેદ પડ્યો કે બંનેમાં અબોલા થઈ ગયા અને છેવટે એ અબોલા છૂટાછેઠા સુધી પહોંચી ગયા !

પંખો તો સગવડ માટે લાવ્યા હતા. કોઈ પણ ખૂણામાં તે મૂકાત તો પણ તે હવા તો આપવાનો જ હતો. પણ ઓછી અને ખોટી સમજણના કારણે પતિ-પત્ની બંનેમાંથી કોઈપણ પોતાનો હઠાગ્રહ ન છોડી શક્યા અને તેથી અણધાર્યું મહાદુઃખ વહોરી બેઠા !

વધુ ઉમરના કારણો, કે વધુ ભણતરના કારણો, કે વધુ દ્રવ્યના કારણો, કે મોટું કુટુંબ વગેરેના કારણો કોઈ મોટું થઈ શકતું નથી પરંતુ સાચી સમજણના કારણો, ક્ષમા આપવાની ઉદારવૃત્તિના કારણો “મોટા” બની શકાય છે.

પતિ-પત્ની બંને પક્ષમાંથી કોઈ એક પક્ષે પણ જો સાચી સમજણ દ્વારા ઉદારવૃત્તિ દાખવીને એમ વિચાર્યું હોત કે “સામો પક્ષ તો સમજવાનો નથી જ, સામાના જડપણાના કારણો બંને દુઃખી થઈશું. પણ જો હું સમજને મારો હઠાગ્રહ મૂકીશ તો હું તો સુખી થઈશ જ અને સાથે-સાથે સામા પક્ષને પણ સુખી કરી શકીશ. પંખો ભલે ગમે તે ખૂણામાં મૂકાય પણ તે પોતાનું હવા ફેંકવાનું કાર્ય તો કરવાનો જ છે.” તો બંને પક્ષ સુખી થઈ શકત.

પંખો તો એક માત્ર દ્વિદાંત છે. જીવનમાં આવતી અન્ય સમસ્યાઓનું સમાધાન પણ સાચી સમજણ દ્વારા કરી લેવું ઘટે. જે સિદ્ધાંત એક વ્યક્તિ કે એક કુટુંબને લાગુ પડી શકે છે તે આખા સમાજને અને આખા વિશ્વને લાગુ પડી શકે છે. સાચી સમજણ દ્વારા ઉદાર બનીને પોતાને અને સામાને સુખી કરવાનો સોનેરી અવસર ચૂકી જઈશું તો પસ્તાવું પડશે.

- યોગબિલ્સુ

### ઓમ્ પરિવારના કાર્યક્રમ

તા. ૧-૫-૮૪ - હનુમાન જ્યંતિ નિમિત્તે

મુ.પો. જ્યદેવપુરા, તા. કડી. જી. મહેસાણા.

## અષ્ટામબરા

(અષ્ટામબરા ઓટલે આનુભવયુક્ત સત્યથી ભરેલું)

(બહુજનહિતાય - બહુજનસુખાય)

ઓપ્રિલ-મે-જૂન (ત્રિમાસિક)

VOL-III (93-94)

ISSUE-IV

માનદ તંત્રી : નૈધય વ્યાસ

## યોગી શ્રી અમૃત દેસાઈનો આનિત્રાય

(મૂળ અંગેણમા)

**YOGA SERVICES INC.**

ઓગાષ ૨૨, ૧૯૯૪

શ્રી યોગભિકુઞ્જનો આધ્યાત્મિક સંદેશ હું જ્યારે  
વાંચું છું ત્યારે ઉડી સંવેદના અનુભવું છું.

તેમના જ્ઞાનસભાર શબ્દોમાં એવી વિરલ શક્તિ  
સમાપેલી છે કે કદય અને આત્માનાં ગણનતમ પડો  
એના સ્પર્શથી સંવેદિત થઈ ઊઠે છે.

તેમની શબ્દોની પસંદગી એટલી સચોટ અને  
સખમ હોય છે કે એક પણ શબ્દ બદલવાનો પ્રયત્ન

કરવા જતાં તેમના આધ્યાત્મિક સંદેશનું મહત્વ ઓછું  
થઈ જવાની સંભાવના રહેલી છે.

વધુ ને વધુ જિજ્ઞાસુઓ તેમનો પ્રેરક સંદેશ પ્રાપ્ત  
કરી તેમના જીવનનો અંતિમ ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરતા  
રહે એ જ અભ્યર્થીના.

સપ્રેમ

યોગી અમૃત દેસાઈ

કૃપાલુ આશ્રમ,

લેનોલ એમએ ૦૧૨૪૦

પુ. એસ. એ.

## શાંતિ

(પાતંજલ યોગાશ્રણ - સાધનપાદ)

યોગભિકુ

વિવેકી જનો માટે આત્મતિક સુખ - મોક્ષ સિવાયનાં  
તમામ સુખો પરિણામરૂપે, તાપરૂપે અને સંસ્કારરૂપે  
તેમજ નિગુણની દાટિએ હુંઘ જ છે. આ માટેનું

સાધનપાદનું પદરમું સૂત્ર “પરિણામતાપસંસકારદૃગેર્ગુણ  
વૃત્તિવિરોધાચ્ચ દુઃખમેવ સર્વમું વિવેકિનः” વિસ્તારપૂર્વક  
સમજ્યા. સધળાં હુંઘો અને સુખો ઉપરોક્ત રીતે

હુઃખો જ છે. હુઃખોથી પર થઈ જવાનું છે. પર ક્યારે થઈ જવાય કે જ્યારે જીતિ, આયુષ્ય અને ભોગ (દેહ) જ ન હોય, ફક્ત “તેવલ્ય” જ હોય. કેવળ ‘સ્વ’ હોય, કોઈ ‘પર’ ન હોય, ત્યારે તમામ સુખહુઃખોથી પર થઈ શકાય છે.

હેય હુઃખમાગતમ્ ॥ ૧૬ ॥

ભાવાર્થ : આવનારાં હુઃખોને હટાવી દઈએ.  
(તેનાથી મુક્ત રહીએ).

વિસ્તાર : હુઃખોની વાત ચાલી રહી છે. જે બધાં હુઃખો આપણો ભોગવી ચૂક્યાં છીએ, હવે તેની ચિત્તા નથી, હાલમાં જે હુઃખો આપણો ભોગવી રહ્યાં છીએ તે ભોગવીને જ પૂરાં કરવાનાં છે. તે સિવાય તેમાંથી છૂટકો નથી. તો હવે આપણો રેના માટે પ્રયત્ન કરી શકીએ ? જે હુઃખ આવી પડવાનું છે તેના માટે આપણો કાઈ ઉપાય કરી શકીએ. જે હુઃખોને ભોગવી ચૂક્યાં તે તો પૂરાં થઈ ગયાં, હાલમાં જે હુઃખોને ભોગવી રહ્યાં છીએ તે ભોગવ્યા સિવાય તેમાંથી છૂટી શકીએ નહીં, તેને ભોગવીને જ પૂરાં કરવાનાં છે. પરંતુ વર્તમાન હુઃખોને આપણો ભોગવી લઈએ ત્યાર પછી બીજાં હુઃખો આવી પડશે. જેમ અત્યારે જે આવી પડ્યાં છે તે પહેલાં તો નહોતાં ને ? એમ હવે આવનારાં હુઃખો, ‘અનાગતમ્’ એટલે કે હજુ આવ્યાં નથી પણ જેની આવવાની શક્યતા છે તેમને રોકી શકીએ. જો હાલમાં એવો પ્રયત્ન કરીએ, હાલમાં એવું જીવન જીવીએ, હાલમાં એવાં સતક થઈ જઈએ, એવો યોગાભ્યાસ કરીએ, ગુરુજનોના સંપર્કમાં રહીએ તો આવનારાં હુઃખોને અટકાવી શકીએ. આવવાનાં છે તે પણ આવી ચાયા પછી વર્તમાન થઈ જાય કે જે અત્યારે ભવિષ્યનાં છે. પણ ભવિષ્યને વર્તમાન થઈ જવામાં શી વાર લાગવાની હતી ? ભવિષ્યમાં રહેલાં હુઃખો માટે અત્યારથી સાવધાન રહીએ તો તે આવી

જ શકે, તેને આપણો અટકાવી શકીએ.

આવી પડનારાં જે હુઃખો છે તેમને તો આપણે ટાળી શકીએ, હટાવી શકીએ. વર્તમાન જીવન એવું આસક્તિ વિનાનું જીવીએ કે જેથી વાસના અને કર્મશાય જ ન બંધાય અને દેહ જ ધારણ ન કરવો પડે; અને તેથી દેહ ધારણ કરવાથી પાપ-પુષ્પના કરણો જે હુઃખસુખ ભોગવાં અનિવાર્ય થઈ જાય છે તેનાથી મુક્ત રહી શકીએ.

યોગદર્શિનના આ ચાર મુખ્ય પ્રતિપાદ વિપયો  
છે- હેય, હેયહેતુ, હાન અને હાનોપાય. આ વૈદિ  
પ્રતિપાદ વિપયોનું બૌદ્ધ મતમાં “ચાર આર્થ સત્યો”ના  
નામથી વર્ણન કરવામાં આવ્યું છે. આ ચાર કે જેનાં  
નામ બૌદ્ધ મતમાં બદલાઈ ગયાં છે પણ તેમનો અર્થ  
એનો એ જ છે. યોગશાસ્ત્રનો મુખ્ય નિયોડ શો છે ?  
આ ચાર વિપયોની રજૂઆત કરવી તે આખા  
યોગશાસ્ત્રનો નિયોડ છે. તમામ શાસ્ત્રોનો નિયોડ તે  
યોગશાસ્ત્ર છે. જેમકે

આલોક્ય સર્વ શાસ્ત્રાંશિ વિચાર્ય ચ પુનઃ પુનઃ  
ઈદમેકું સુનિષ્પત્તાં યોગશાસ્ત્રાં પરં મતમ્

- અને યોગશાસ્ત્રનો નિયોડ ઉપરોક્ત ચાર સત્યો-  
સિદ્ધાંતોની રજૂઆત કરવી તે છે. તે ચારને સમજાએ.

હેય : હેય એટલે ત્યાજ્ય. ‘હુઃખ’ એમ ન કહેતાં  
આ જગ્યાએ હેય કહું. હેય એટલે ત્યાજ્ય, ત્યાગવ,  
પોગ્ય, ગ્રહણ કરવાને યોગ્ય નહીં. ત્યાગવા યોગ્ય શું  
છે ? હુઃખો, પંચકલેશો વગેરે.

હેયહેતુ : જે ત્યાગવાને યોગ્ય છે તેને ત્યાગી  
દેવાં જોઈએ. પણ ત્યાગી શકીએ કઈ રીતે ? તેનું  
કરણ જાણવું જોઈએ. હેયનું એટલે કે હુઃખનું અને  
હેતુ એટલે કે કરણ જાણવું જોઈએ. તો જ તેને  
ત્યાગી શકીએ. હુઃખોને શા માટે ત્યાગી દેવાનાં છે ?

બીજું કાઈ ગ્રહણ કરવાનું છે તેથી, કોઈ પરમ વસ્તુને પ્રાપ્ત કરવાની છે તેથી ત્યાજ્યને ત્યાગી દેવાનાં છે, કલેશો અને દુઃખો ત્રાસ આપે છે એટલે તેને ત્યાગી દેવાનાં છે અને આત્મિતિક સુખને પ્રાપ્ત કરવાનું છે.

**હાન :** હાન એટલે કેવલ્ય, અહીં કેવલ્યને બદલે હાન શાન્દ વાપર્યા છે, દુઃખો અને કલેશોને ત્યાગી, તેના બંધનમાંથી મુક્ત થઈ કેવલ્ય પ્રાપ્ત કરવાનું છે.

**હાનોપાય :** તે હાનનો એટલે કે કેવલ્યનો ઉંડ શો ? તે કેવલ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ ? એ જે ત્યાજ્ય, ત્યાગવાને યોગ્ય, અનાગતમું એવાં જે દુઃખો છે તેને ત્યાગી દેવાં જોઈએ, જે દુઃખ વ્યતીત થઈ ગયાં, આપણે ભોગવી લીધાં તેમની તો કોઈ ચિંતા નથી, તેમને તો ત્યાગવાની કોઈ જરૂરિયાત નથી કરશું કે એ તો ભોગવાઈ ગયાં. લાલમાં, વર્તમાનમાં જે દુઃખો ભોગવી રહ્યા છીએ તે ભોગવે જ છુટ્ટો છે, ભોગવા વિના તે દુઃખો ટળી શકે તેમ નથી. ભોગવી લીધા પછી તે બીજી કષણમાં રહેવાનાં નથી, જે જે કાઈ કર્માશય બંધાયું છે તેના દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે ? ભોગ, તેને ભોગવી લેવાં જોઈએ, ભોગવી લીધા સિવાય તેમાંથી છૂટી ના શકાય એવો કર્મનો અટલ નિયમ છે, ગીતામાં કહું છે કે, ‘ગઢના કર્મઓ ગતિ’ કર્મની ગતિ ગઈ છે. તેને કોઈ પૂર્ણ સમજું કે પાચી શકતું નથી. કર્મના પણ ધર્મ પ્રકારો છે, શુદ્ધ કર્મ, અશુદ્ધ કર્મ, મિશ્રિત કર્મ, તે બધાંથી જે કર્માશય બંધાય છે અને તેનાથી જે કાઈ નિશ્ચિત થયેલું ભોગવું પડે છે, તે ભોગવીને કર્માશયનો લય કરી શકાય છે. આચાય એટલે આગાર, લંડાર, જથ્યો, કર્મનો લંડાર કે જે સૂક્ષ્મિયે રહેલો છે તે કેવો છે ? કર્મને અતિ સૂક્ષ્મ રૂપમાં રાખવા માટેનું એક એવું અગમ્ય, રહસ્યમુક્ત સ્થાન કે જેમાં અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મતર,

સૂક્ષ્મતમ રૂપે કર્મના સંસ્કારોનો આપો જથ્યો વાસનાઓ રૂપે એકદો થયેલો હોય છે, તે બધાંને ભોગવી ભોગવીને તેમાંથી મુક્ત થવાય છે, સત્કર્મો કરીને જે પુષ્પ એકહું કરેલું હોય, અસત્કર્મ કરીને જે પાપ એકહું કરેલું હોય તે પુષ્પ-પાપના શુદ્ધ-દુઃખ રૂપી સંસ્કારોને, તે શુદ્ધ અને દુઃખને ભોગવવાં જોઈએ, તે ભોગવીને તેમાંથી મુક્ત થવાય. જે કોઈ શરીરસ્થાની છે, બલે તે ભગવાનનો અવતાર હોય કે મહાત્મા હોય કે ધોરી હોય; પણ જો દેહ ધારક કર્યા છે તો દેહનો ધર્મ છે કે કર્મને ભોગવવાં અને ભોગવીને તેમાંથી મુક્ત થવું.

ક્યારે, કયું કર્મ, કઈ રીતે ઇન આપવા ઉન્મુખ થશો તે કોઈ કલી શકતું નથી. કર્મની ગતિ ગઈ નથી. તેને કોઈ પાચી શકે નહીં. તે પોતાની રીતે નિયમપૂર્વક કર્મ કર્યે જતી હોય છે. તો, જે કર્મને આપણે ભોગવી લીધું તે ભૂતકાળનું થઈ ગયું, તેની ચિંતા નથી. વર્તમાનકાળમાં જે કર્મ ભોગવી રહ્યા છીએ તે પણ ભૂતકાળના થતાં જશે. જેમ જેમ કષ્ટો વીતતી જાય છે તેમ તેમ તેમાંથી આપણે મુક્ત થતાં જઈએ છીએ. તો હવે આપણે શું કરવાનું છે તે સોણમાં સૂત્રમાં કહું. જે દુઃખ અવિષ્યકાળમાં પડેલું છે અને આવવાનું છે તેને અટકાવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. ભૂતકાળનાં અને વર્તમાનકાળનાં દુઃખમાંથી મુક્ત થવા કોઈ પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી, તેમાં કોઈ પ્રયત્ન કર્મ લાગી શકે તેમ નથી. આપણો પુરુષાર્થ શેમાં કર્મ લાગી શકે ? ‘અનાગતમું’ - આવનારાં દુઃખમાંથી મુક્ત થવામાં.

અવિષ્યમાં જે દુઃખ આવી શકવાની સંભાવના છે તેને આપણે ટાળી શકીએ, વર્તમાનકાળમાં એવો પ્રયત્ન કરીએ, એવો પુરુષાર્થ કરીએ, વર્તમાનકાળમાં એવી સાધના કરીએ કે જેથી નવાં દુઃખોને આમંત્રણ મળે જ નહીં, આપણે જે કાઈ માયા રચી દીધી છે, જે

કાંઈ પથારો પાથરી દીધો છે તેને તો સમેટવો જ પડશે. કહે છે ને કે “પલાળ્યુ હોય તેટલું મૂડાવવું જ પડે.” તેથી જેટલું પલાળ્યુ છે તે તો મૂડાયે જ છૂટકો છે. પરંતુ ફરીફરીને પલાળતાં ન રહીએ, ફરીફરીને નવો પથારો કરતાં ન રહીએ તે આપણા હાથની વાત છે. જે પથારો પથરાઈ ગયો છે તેમાંથી ભાગી છૂટવાનું નથી, તે ફરજો અને જવાબદારીઓ તો પૂરી ‘અદા કરવાની છે, જ્યા મારીને પૂરી કરવાની છે. તમારે ન કરવી હોય તો પણ તે કરાવવામાં આવશે. કર્મનો સિદ્ધાંત તમારી પાસેથી તે તમામ જવાબદારીઓ ચોટી પકડીને અદા કરાવશે. તેનાથી ભાગી નહીં શકાય. એ બધું તો બોગવીને જ સમામ કરવું પડશે.

હાલમાં એવાં કર્મો કરતાં રહીએ કે જેથી બવિષ્ણનાં દુઃખોને-દેહોને આમંત્રણ ન મળે. જો દેહ પારણ કરીએ તો બધી મોહમાયાજળમાં ફસાઈને દુઃખો બોગવવાં પડે છે. પણ જો દેહ જ ન હોય તો? શરીર જ ન હોય તો? દુઃખોમાંથી સંપૂર્ણ મુક્તિ.

**દૃષ્ટદૃષ્યયો: સંયોગો હેયહેતુ: ॥ ૧૭ ॥**

**આવાર્થ :** દ્રષ્ટા અને દૃષ્યનો સંયોગ દુઃખોનું કારણ છે.

**વિસ્તાર :** હેયહેતુ - તે હેયનો હેતુ, તે દુઃખોનું કારણ શું છે? આપણે, આવી પડનારાં હેયને-ત્યાજ્યને-દુઃખોને જો આવવા નહીં દેવાં હોય તો તે કઈ રીતે આવે છે, તે દુઃખોનું કારણ શું છે વગેરે સમજવું પડશે. નહીં તો તે અટકાવી શકીશું નહીં. આ સૂત્રમાં દુઃખોનું કારણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. દ્રષ્ટા અને દૃષ્યનો સંયોગ તે જ ‘હેય’નો હેતુ છે, તે જ આ ‘ત્યાજ્ય’ દુઃખોનું કારણ છે. દ્રષ્ટા અને દૃષ્યનો સંયોગ થવો, તે બંનેનું મિલન, તે બંનેનો યોગ થવો તે આ બધાં દુઃખોનું કારણ છે. દ્રષ્ટા કોણ છે? ચેતન પુરુષ દ્રષ્ટા છે. ચેતન પુરુષ સિવાય બધાં કેવાં છે? જી છે.

પ્રકૃતિ-અવિકૃતિ, પ્રકૃતિ-વિકૃતિ, વિકૃતિ-અપ્રકૃતિ - જે તત્ત્વના આટલા ભાગ પડે છે - (૧) જે કેવળ કારણ છે પણ કાર્ય કોઈનું નથી તે, (૨) જે અમુકનું કારણ છે અને અમુકનું કાર્ય છે તે અને (૩) જે કેવળ કાર્ય છે પણ કારણ કોઈનું નથી તે. જેમકે (૧) મૂળ પ્રકૃતિ (અલિંગ) ચોવીસમું તત્ત્વ તે કેવળ “કારણ” છે, કોઈનું “કાર્ય” નથી. (૨) મહત્ત્ત્વ, અહંકાર અને પંચતન્માત્રાઓ એ સાતેય કારણ અને કાર્ય બંને છે. જેમકે મહત્ત્ત્વ મૂળ પ્રકૃતિનું કાર્ય છે પણ અહંકારનું કારણ છે. અહંકાર મહત્ત્ત્વનું કાર્ય છે અને પણ તન્માત્રાઓનું કારણ છે. અને પાંચેય તન્માત્રાઓ અહંકારનું કાર્ય છે અને પાંચ સ્થૂળ ભૂતોનું કારણ છે. (૩) પાંચ સ્થૂળ ભૂતો પાંચ તન્માત્રાઓનું કાર્ય છે અને અગ્નિધાર ઈન્દ્રિયો અહંકારનું કાર્ય છે, જેથી તે સોણે કેવળ કાર્ય જ છે, કોઈનું કારણ નથી. (ઉપરોક્ત ચોવીસ તત્ત્વોને આપણે ઓગણીસમા સૂત્રમાં વિસ્તારપૂર્વક સમજશું) આ રીતે ચોવીસે જડતત્ત્વો એકબીજાનાં કારણ-કાર્યો છે. પરંતુ પચ્ચીસમું ચેતનતત્ત્વ ‘દ્રષ્ટા’ તે તો માત્ર અપ્રકૃતિ-અવિકૃતિ છે, એટલે કે તે કોઈનું કારણોય નથી કે કોઈનું કાર્યોય નથી, તેનું કોઈ કારણોય નથી કે કાર્યોય નથી. આ રીતે ચેતન પુરુષને સમજવાનો વધુમાં વધુ પ્રયત્ન થઈ શકે. ચેતન પુરુષને સમજવા માટે ઘણું બધું કહેવાઈ ગયું. આ રીતે આપણે “દ્રષ્ટા-આત્મા-જીવત્તમા”ને સમજયા. હવે દરેક સમજએ:

પ્રકૃતિ અને વિકૃતિમાં દૃષ્યોનો સમાવેશ થઈ જાય છે. દ્રષ્ટા-આત્મા માટે સાક્ષી, નિત્ય, કૂટસ્થ વગેરે વણા શબ્દો વપરાયા છે. પરંતુ તે શબ્દો સંપૂર્ણ અર્થને પ્રગટ કરી શકતા નથી. પણ આપણે જીવારે તેના વિષે કાંઈ વાતચીત કરવી છે, તેના માટે કાંઈ ઊઠાપોહ કરવો છે, તેને શબ્દો દ્વારા સમજવાનો પ્રયત્ન કરવો

છે, તેને વૈખરી વાક્યોમાં વ્યક્ત કરવો છે ત્યારે શબ્દોના માધ્યમ સિવાય આપણો અન્ય શાનો ઉપયોગ કરી શકીએ ? જો વાતચીતથી તેને સમજવાનો પ્રયત્ન કરવો છે તો વાતચીત રેના દ્વારા થઈ શકશે ? વાતચીત તો વાક્યી દ્વારા થઈ શકશે. અને વાક્યી શું છે ? તે અભિરો, શબ્દો અને વાક્યોનો સમૂહ છે. આ રીતે શબ્દોનો આશરો લેવો પડશે. તેથી તેના માટે નિત્ય, કૂટસ્થ વગેરે શબ્દો વપરાયા છે. તેના માટે બીજો એક સરસ શબ્દ છે “અપરિણામી”. આ શબ્દથી આત્મા લિંગ ધંધો બધો ખ્યાલ આવી શકે છે. મૂળ પ્રકૃતિ માટે ‘અલિંગ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. અલિંગ, અવ્યક્ત, સામ્યાવસ્થા, માયા વગેરે એકાર્થી, પર્યાપવાચી, સમાનાર્થી શબ્દો છે. એ પ્રકૃતિ- એ મૂળ પ્રકૃતિ માટે પ્રકૃતિ શબ્દ છે. પછી તેમાંથી બધી વિકૃતિઓ - વિશેષ કૃતિઓ થાય છે. ‘વિકૃતિ’ શબ્દ આપણો આપણા સામાન્ય વ્યવહારમાં પણ વાપરીએ છીએ. દૂધ વિકૃત થઈ ગયું, તે ખાવાને લાયક ના રહ્યું. આપણો વિકૃત શબ્દનો શો અર્થ કરીએ છીએ ? વિકૃત થયું એટલે બગડી જલ્દું. ખરેખર દૂધ બગડ્યું નથી પરંતુ તે આપણા ઉપયોગમાં આવી શકે તેમ નથી, આપણો તેને પી શકીએ તેમ નથી, તેનો દૂધનો સ્વાદ રહ્યો નથી તેથી તેને આપણો બગડી ગયું છે તેમ કહીએ છીએ. તે જમવા માટે અયોગ્ય થઈ ગયું છે તેથી તેના માટે જ હો “બગડી ગયું” શબ્દો વાપર્યા. પરંતુ તે બગડી ગયું નથી પણ વિકૃત થયું છે, તેમાં વિકૃતિ આવી ગઈ છે. આ શબ્દ સાચો છે. વિ+કૃતિ = વિશેષ કૃતિ, તેની કોઈ વિશેષ બનાવત થઈ, દૂધ બગડી ગયું એટલે તેનું જે પ્રવાહીપણું હતું તેમાં થોડી ઘટતા આવી. જે સ્વાદ હતો તેમાં થોડી ખરાશ આવી. જે રીતની દૂધની કૃતિ હતી તેમાંથી એક વિશેષ કૃતિ થઈ તેથી તેને આપણો વિકૃત કર્યું.

આમ, પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી પછી જે લિંગમાત્ર, અવિશેષ, વિશેષ ઈત્�ાદિ તે વિકૃતિઓ. અલિંગ એટલે વિદ્ધન પણ નહીં. જે ‘લિંગમાત્ર’ હતું તે એક વિદ્ધન હતું; જ્યારે અલિંગ એટલે તેનું કોઈ વિદ્ધન પણ નહીં, વિદ્ધન ન હોવાપણું એટલે અવ્યક્ત, હજુ વ્યક્ત નથી એવી સ્થિતિમાં. આ જડ પદાર્થો, આ જે જડ જગત, એટલે કે ચેતન પુરુષ સિવાયનું જે કાંઈ છે તે તમામ, તે જ્યારે અવ્યક્ત અવસ્થામાં હોય ત્યારે તેને પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ માટે પણ નિત્ય શબ્દ વપરાયો છે અને પુરુષ માટે પણ નિત્ય શબ્દ વપરાયો છે. તે બંને નિત્ય છે. પરંતુ જડ પ્રકૃતિ કે જે મૂળ પ્રકૃતિમાં હતી, જે અવ્યક્ત અવસ્થામાં હતી તેનું નિત્યપણું કઈ રીતે છે ? તેનું નિત્યપણું પરિવર્તન પામવાવાળું છે. તે નિત્ય તો છે જ, તેનો નાશ નથી. જેમકે દૂધમાંથી દહી થયું, દહીમાંથી કાંઈ બીજું થયું, પછી કાંઈ ત્રીજું થયું.

ધારને ગાયોએ ખાયું અને તેમાંથી લોહી થયું. દૂધ થયું. એ દૂધ વાઇરાગે પીયું. તેમાંથી તેનું શરીર બંધાયું. તે શરીર કાળજીમે પડી ગયું. તેની મારી થઈ ગઈ. આમ, જે કાંઈ જડ પદાર્થો છે તેમાં વિકૃતિ આવતી જાય છે, તેમાં પરિવર્તન આવતાં જાય છે. રૂપ, રંગ અને આકૃતિમાં બદલીઓ આવતી જાય છે. તેથી તેનું જે વ્યક્ત સ્વરૂપ હતું તે તેનું તે જ ન રહ્યું. પરંતુ દૂધમાંથી દહી થયું ત્યારે દૂધ કાંઈ ચાલ્યું ના ગયું, દૂધનો કાંઈ સર્વાંશે નાશ ન થયો, તે દહીરૂપે તો અસ્તિત્વમાં રહ્યું જ. આ રીતે તે નિત્ય છે. તે નિત્ય તો છે પણ કેવું નિત્ય ? તે પરિવર્તનવાળું નિત્ય છે, તે જડ તત્ત્વોનો સર્વાંશે નાશ નથી પરંતુ આવી રીતે તે પરિવર્તિત થતાં જાય છે - તોથે મૂળ સ્વરૂપે તો તે રહે જ છે. આ રીતે તે નિત્ય છે. અને ચેતન પુરુષ આત્મા-દ્રષ્ટા પણ નિત્ય છે. પરંતુ તેનું નિત્યપણું કેવું

છે ? "અપરિવર્તનશીલ નિત્યપણું". - તેમાં પરિવર્તનો નથી આવતાં. તે જેવું છે અને જેમ છે તેમ જ સદાસર્વદા અમંડ નિકળમાં પણ રહે છે, તેનું નિત્યપણું તેવું છે. તેમાં પરિવર્તનપણાવાળું નિત્યપણું કહી નથી આવતું. આ રીતે તેવા નિત્યપણાને સમજાવવા, તેના માટે "અપરિષામી" શબ્દ વાપર્યો તે ખૂબ સાર્થક છે, તે તત્ત્વ, તે ચેતનતત્ત્વ પરિષામને નથી પામતું. તે સિવાય જે કાંઈ છે તે પરિષામી છે, તેમાં પરિષામો થયાં કરે છે. અમુકનું પરિષામ અમુક અને અમુકનું પરિષામ અમુક, એમ તે "પરિષામી નિત્ય" છે.

હેય(હુઃખ)નું કારણ દ્રષ્ટા અને દર્શયનો સંયોગ છે. દ્રષ્ટા કહેતાં અપરિષામી નિત્ય એવો આત્મા અને દર્શય કહેતાં પરિષામી નિત્ય એવી પ્રકૃતિ, તે બનેનો સંયોગ, તે બનેનું બિલન તે જ હેયહેતુ- હુખનું કારણ. તેથી દ્રષ્ટા અને દર્શયને સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. પતંજલિ મુનિ અધ્યારમા સૂત્રમાં 'દર્શય'ને વધુ વિસ્તારપૂર્વક સમજાવી રહ્યા છે.

### પ્રકાશકિયાસ્થિતિશીલં ભૂતેન્દ્રિયાત્મક ભોગાપવર્ગાર્થે દર્શયમ् ॥ ૧૮ ॥

**ભાવાર્થ :** સત્ત્વ, રજ અને તમ જેનો સ્વભાવ છે અને ભૂત અને ઈન્દ્રિયો જેનું સ્વરૂપ છે તેવાં દર્શયનું પ્રયોજન ભોગ અને અપવર્ગ (મોક્ષ) આપવાનું છે.

**વિસ્તાર :** પ્રથમ દર્શયને સમજાવે છે. દર્શય શું છે? તેનો સ્વભાવ કેવો છે? દર્શયનું સ્વરૂપ કેવું છે? દર્શયોનું પ્રયોજન શું છે? દર્શય એટલે આપણે સમજ ગયા. આ જે ચેતનપુરુષ- ચેતનતત્ત્વ સિવાયનું જે કાંઈપણ છે તે સર્વ, તે તમામ 'દર્શય' છે. બહાર જે કાંઈ દેખાઈ રહ્યું છે ત્યાંથી માંડીને આપણું આ શરીર અને શરીરમાં જે કાંઈ છે તે તમામનો સમાવેશ દર્શયમાં થઈ જાય છે. દ્રષ્ટાનો દર્શય સાથેનો સંયોગ એ જ હુઃખોનું મૂળ કારણ છે. તેથી પ્રથમ તો તે દર્શયને

સમજાઓ. તે દર્શયનો સ્વભાવ કેવો છે? તેનું સ્વરૂપ કેવું છે? તેનું પ્રયોજન શું છે? દર્શયો શા માટે છે? તેસમજાઓ.

દર્શયોનો સ્વભાવ પ્રકાશ, કિયા અને સ્થિતિવાળો છે. પ્રકાશ એટલે સત્ત્વગુણ, કિયા એટલે રજોગુણ અને સ્થિતિ એટલે તમોગુણ. પ્રકાશનો એક અર્થ છે જ્ઞાન અને બીજો અર્થ છે અજ્વાળાં. જેમ જેમ સત્ત્વગુણની વૃદ્ધિ થતી જાય તેમ તેમ આપણી અંદર જ્ઞાન અને અજ્વાળાણની વૃદ્ધિ થતી જાય છે. બહાર દીવો કરવાથી અંધકારનો નાશ થઈને જેવું અજ્વાળાં થાય છે. જેવું અજ્વાળાં શરીરની અંદર થાય છે અને તે અજ્વાળાં દ્વારા જ્ઞાનનું અજ્વાળાં થાય છે. પ્રથમ જ્યોતિરૂપે પ્રકાશ થાય છે અને પછી તે જ્ઞાનરૂપી પ્રકાશમાં બદલાઈ જાય છે, જ્યોતિરૂપી અજ્વાળાં અમુક સમય સુધી રહે છે અને પછી ચાલ્યું જાય છે, પરંતુ તે જ્ઞાનરૂપી અજ્વાળાને-પ્રકાશને સદા માટે મૂકૃતું જાય છે. સમાધિપાદના છતીસમા વિશોકા વા જ્યોતિભાતી" સૂત્રમાં જે જ્યોતિર્દર્શનની વાત છે તેવી જ્યોતિ સાધકના દર્શયસ્થાનમાં પ્રગટ થાય છે. આ જ્યોતિ કેવી છે? વિશોકા, શોક વિનાની, તમામ શોકનો નાશ કરી દે અને હર્ષ તથા આનંદને આપે તેવી જ્યોતિના શરીરમા દર્શન થાય છે. અમુક સમય અને કાળ માટે તે જ્યોતિના દર્શન થાય અને પછી તે ચાલી જાય. 'વિશોકા' સે રેલે કે શોકને ટાળવાવાળી, તે જ્યોતિ શોકને ટાળી દે, તના દર્શન થયા પછી શોક ટકી ન શકે, શોકને તે કઈ રીતે હટાવી દે? જ્ઞાનને, તત્ત્વજ્ઞાનરૂપી પ્રકાશને તે સદા માટે મૂકૃતી જાય તેથી અજ્ઞાનરૂપી શોક ટળી જાય, જેમ યભેચ્છાયુદ્ધી બહારની જ્યોતિનો પ્રકાશ દેખાય છે તેમ, તેવી જ જ્યોતિ અંતર્યસુધી શરીરમાં દેખાય છે. તેની કેટલી સમયમાંદા હોય તેટલો સમય તે રહે અને પછી ચાલી જાય. પરંતુ પાછળ તે જ્ઞાનરૂપી પ્રકાશને

મૂકી જાય. તેથી હુમેશા શોકરહિત થઈ જવાય.

સાધનામાં પ્રથમ શું થવા લાગે છે? તમોગુણાને રજોગુણ ઘટવા લાગે છે અને સત્તવગુણાની વૃદ્ધિ થવા લાગે છે. સાધકો મશ્રો કરે છે કે બાપજી! મને અમુક અનુભવો થયા, મને અમુક દરથ્ય દેખાયું, જાણો કે અમુક દેવદેવી આવ્યાં, જાણો કે અનંત પ્રકાશના સમુદ્રમાં હું તરતો હોઉં એવું મને લાગ્યું વળેરે વળેરે. આમ અનેક સાધકોને અનંત પ્રકારના અનુભવો થાય છે. તે શાને આભારી છે? સત્તવગુણાની વૃદ્ધિને તે આભારી છે. સાધનામાં જ્યારે આગળ વધાય છે, પ્રાણાયામ અને પ્રત્યાહારનો ખૂબ અત્યાસ ચાલતો હોય છે ત્યારે પ્રાણ ઉદ્ધર્મમુખ થઈ જાય છે. પ્રાણ અયોમુખ મટીને ઉદ્ધર્મ તરફ પ્રયાણ કરે છે ત્યારે પણ આવા દેવી અલોકિક અનુભવોની પ્રાપ્તિ થાય છે. તેથી શું સમજવાનું છે? જ્યારે ઉપરોક્ત અનુભવો થાય ત્યારે શું સમજવાનું છે? સત્તવગુણાની વૃદ્ધિ થઈ રહી છે અને સત્તવગુણ દ્વારા પ્રાણોત્થાન થઈ રહ્યું છે. આમ સમજુને તે વખતે હર્ષ અનુભવવો. પરંતુ સાધનામાં મંદતા આવવા દેવી નહીં અને આગળને આગળ વધે જવું. અમુક ભૂમિકા સુધી પહોંચી ગયા પછી તેવા કોઈપણ અનુભવોની પ્રાપ્તિ થતી નથી કે કોઈપણ પ્રકારની આંતરિક ડિયાઓ પણ થતી નથી. તેથી નિરાશ થઈ જવું ન જોઈએ. કારણ કે આપણી સ્થૂળ ભૂમિકા પૂરી થઈ છે. સ્થૂળ ભૂમિકાથી આપણે આગળ વધી શ્વયા. તેથી તેવા સ્થૂળ અનુભવો આપણાને ન થાય તો તેથી હતાશ થઈને સાધનાને છોડી દેવી ના જોઈએ. અને જ્યારે અલોકિક આંતરિક અનુભવો થતા હોય ત્યારે તેમાં જ રાચતા રહીને પોતાના સાધનાલ્યાસમાં મંદતા આવવા ન દેવી.

તો આમ, પ્રકાશનો અર્થ શાન થયો, એવું શાન કે જે સતત જન્મોજન્મ આપણી સાથે રહે; એવું શાન

કે જેને કોઈ ચોર ચોરી ના શકે, લૂટારો લૂટી ના શકે. તેને જેમ જેમ બીજાઓને આપીએ તેમ તેમ વધતું જ જાય, વધતું જ જાય. બીજા બધા પદાર્થો એવા છે કે તેને આપણે કોઈને આપીએ તો તે આપણી પાસેથી ઓછા થાય, ઘટવા લાગે. શાનરૂપી લંડાર, શાનરૂપી નિધિ એવો છે કે તે વધતો જ જાય, વધતો જ જાય. રાજસૂય પણમાં પાંડવોએ સોનાના દાન માટે દુર્યોધનને રોક્યો હતો ને? શા માટે? દુર્યોધનના હાથમાં પદ્મ હતું તેથી. જેના હાથમાં પદ્મ હોય તે જેટલું દાન કરે તેનાથી અનંત ગણું તેને પાછું મળે. દુર્યોધનની જેમ દરેક મનુષ્યના હાથમાં પદ્મ છે, પણ કોઈને પોતાના હાથમાંના પદ્મની ખબર હોતી નથી. આ એક છૂંપું રહસ્ય છે. જેને ચેતવું હોય તેના માટે આ બાબતનો મહાભારતમાં તો ફક્ત એક ઈશારો કર્યો છે. જો સૌને પોતાના હાથના પદ્મની અને તેના ઉપરોગની ખબર પડી જાય તો સૌ માલામાલ થઈ જાય. પણ પદ્મની અજ્ઞાનતાના કારણે મનુષ્ય બધી રીતે કંગાલ રહે છે. મહાકંજૂસ પોતે તો ઉદાર થઈ શકતો નથી પણ જગતને પણ પોતાની દિશિથી જુએ છે, પોતાની કૂટપદ્મીથી માપે છે. બીજાને ઉદાર હાથે વરતો જોઈને તેના મનમાં બળતરાનો કોઈ પાર નથી રહેતો. પોતાની મૂર્ખતાવશ બીજા ઉદારને પણ તે મૂર્ખ અથવા ચડાઉ અથવા ગાંડો સમજે છે. સર્વગુણસંપત્ત પોતાને જ સમજે છે કારણ કે 'ચમડી તૂટે પણ દમડી ન છૂટે' એવી પોતાની નીતિ છે તેથી. કુદરતની પણ કમાલ કરામત છે. વ્યક્તિદીઠ સૌને પદ્મ આપી દીધું પણ તેની જાણકારી ન થયા દીધી. જેમ આંખ આખા વિશ્વને જોઈ શકે પણ પોતાને જ ન જોઈ શકે. પોતાને જોવા માટે આંખને બીજાની (અરીસાની) જરૂર પડે, જેમ મનુષ્ય પોતાના જ હાથમાંના પદ્મને જોઈ ન શકે, તેની મહતાને

પામી ન શકે, જ્યાં સુધી ગુરુજનો દ્વારા આ રહસ્યને જગ્યાવવામાં ના આવે. ‘તરણા ઓથે કુંગર રે, કુંગર કોઈ દેખે નહીં’ એવી આ વાત છે.

જ્ઞાનદાનની સ્થિતિ પણ પદ્ધવાળા હંથ જેવી છે. જેમ જેમ આપીએ તેમ તેમ વધતું જાય અને વધુ ને વધુ બિલવટ થતી જાય, તે ઘટે નહીં. ચોર ચોરી ન શકે કે લંઠી ન શકે, પાણી ભાજીવી ના શકે, પવન સૂકીવી ના શકે અને આપવાથી જે વધતું જ રહે તેવા જ્ઞાનથી, પ્રકાશથી શું બતાવી રહ્યા છે? દશ્યોનો સ્વભાવ બતાવી રહ્યા છે. તે દશ્યો પ્રકાશ, કિયા અને સ્થિતિવાળાં છે. પ્રકાશ એટલે સત્ત્વગુણ, કિયા એટલે રજોગુણ. રજોગુણ જીવાય કોઈપણ કિયા કરી ન શકાય. સાથના કરવી હશે તો પણ રજોગુણ તો જોઈશે જ. અમૃત પ્રમાણમાં રજોગુણ જોઈશે, નહીં તો સાથના પણ નહીં થઈ શકે. કિયા-હલનયલન-ગતિ તે રજોગુણને આભારી છે. રજોગુણનો સ્વભાવ ‘ગતિ’ છે, અને સ્થિતિ-સ્થિરતા-નિષ્ક્રિયપણું તે તમોગુણનો સ્વભાવ છે.

બધાં જ દશ્યો ત્રિગુણમય છે. વત્તાઓછા પ્રમાણમાં ગ્રંથો ગુણો તેમાં રહેલા છે. આ રીતે તેનો સ્વભાવ કશ્યો. હવે દશ્યોનું સ્વરૂપ જાણીએ. તેનું સ્વરૂપ છે ‘ભૂતેન્દ્રિયાત્મક’ એટલે કે પંચમહાભૂત અને ઈન્દ્રિયોમય. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ, આ પંચમહાભૂત છે. આપણાં તમામાં શરીરો - મનુષ્ય, પણ અને પક્ષી ગ્રંથો યોનિઓના શરીરો શેનાં બનેલાં છે? પંચમહાભૂતનાં બનેલાં છે. તે ગ્રંથો યોનિથી ઉપરની ચોથી યોનિ ‘દેવયોનિ’ છે. તે પંચમહાભૂતમાં નથી આવતી. તેનો સમાવેશ પંચમહાભૂતમાં નથી થતો. પરંતુ આ ગ્રંથો યોનિનાં શરીરો તો પંચમહાભૂતનાં બનેલાં છે, ભૂતાત્મક અને ઈન્દ્રિયાત્મક. હવે ઈન્દ્રિયાત્મક એટલે કે ઈન્દ્રિયોને સમજાયે. ઈન્દ્રિયો દર છે - પાંચ કર્મન્દ્રિયો અને પાંચ જ્ઞાનન્દ્રિયો. આ દર ઈન્દ્રિયો

અને પંચમહાભૂત તે સંઘણું ‘દશ્ય’નું સ્વરૂપ છે. પંચમહાભૂત તે નામ કેટલું સુદર છે! જ્યાં આપવાની શરીરો જ પંચમહાભૂતથી બનેલાં હોય, જ્યાં તે પંચમહાભૂતની લાજરી હોય ત્યાં એકાદ લધુભૂત આવે તો તેની શી વિસાત? એક લધુભૂત પંચમહાભૂતને ડરાવી કે હટાવી શકે? ના. તો પંચમહાભૂતવાળાએ કોઈ એક લધુભૂતથી શા માટે ડરવું જોઈએ? આ સમજા જીવનમાં ખૂબ યાદ રાખવા જેવી છે અને બીજાને પણ સમજાવવા જેવી છે કે તમે પોતે જ પંચમહાભૂત છો તો ડરવાનું કોનાથી? શંકાભૂત પણ તો કદાચ એક અંગ હશે પણ આપણી પાસે તો પાંચેય અંગ, પાંચેય મહાભૂત છે અને પાંચ કર્મન્દ્રિયો તથા પાંચ જ્ઞાનન્દ્રિયો પણ છે. જે ભૂત થાય છે તેમાં આમાંનું કશ્યું જ નથી હોતું તેથી તે આપણનું કાંઈ જ બગાડી શકે નહીં. માટે શંકાભૂતથી કદી ડરવું નહીં. તેના કરતાં આપણામાં વિશેષતા છે. એક વિશેષતા તે ‘પાંચ’ની અને બીજી વિશેષતા તે ‘મહા’ની. આપણામાં આટલી તો અવિકતા, વિશેષતા છે.

હવે કહેવામાં આવે છે દશ્યોનું પ્રયોજન. ‘ભોગાપવર્ગાર્થી દશ્યમુ’ - આ દશ્યોનું પ્રયોજન ‘ભોગ’ અને ‘અપવર્ગ’ આપવાનું છે. અપવર્ગ એટલે મોક્ષ. દ્રષ્ટાને - આત્માને - ચેતનપુરુષને તે ભોગ અને અપવર્ગ (મોક્ષ-કૈવલ્ય) આપે છે. ભોગ એટલે ભૌતિક સુખો અને અપવર્ગ એટલે કૈવલ્ય. દ્રષ્ટા ભૌતિક સુખો, ભોગવતો-ભોગવતો એક કાળે તેનાથી ઉપરામ થઈને કૈવલ્યને પ્રામ કરી લે છે. તો આ રીતે, આ દશ્યોનો સ્વભાવ અને તેનું સ્વરૂપ સમજાયું. અને તેનું પ્રયોજન શું છે તે પણ કશ્યું, અને આવાં દશ્યોનો દ્રષ્ટા સાથેનો સંપોગ તે ‘હેયહેતુ’ દુઃખનું કારક છે. અસ્તુ,

(કમશઃ)

(“શાંતા” પુસ્તકમાંથી સાભાર)

# ગંગોત્રી ગંગાનીની ચાગાએ

સંકલન : શેખર પટેલ

ઉત્તરકાશીથી ગંગોત્રી જવા માટે અમે સૌ એક જ જીપમાં ગોઠવાયા. સામાન બહુ હતો તેથી બધાને બેસવાની સંકદશ પડતી હતી. તે જોઈ પ. પૂરુ ગુરુદેવ શ્રી પોગલિશુદ્ધાએ કહ્યું ‘બધાને ફાવે છે ને ? અંદર અંદર બાર એડજસ્ટ થઈ ગયા ને ?’ એક જ વાક્યમાં પૂરુષશ્રીએ અમને સૌને અણામોલ શિખામણ આપી દીધી કે જીવનવહેવારમાં પણ એકબીજાને અનુકૂળ થઈને જીવશો તો જરાય તકલીફ નહીં પડે. આમ જ્ઞાન સાથે ગમત કરતા કરતા આજુબાજુનું પ્રાકૃતિક સૌદર્ય માણાતા અમે મુસાફરી કરી રહ્યા હતા. ઉત્તરકાશીથી લગભગ ૧૮ કિ.મી. દૂર ગંગનાની આવે છે. ગંગનાનીમાં ગરમ પાણીના કુડ છે. અમે ગંગનાની આવતાં કુડ જોવા નીચે ઉત્તર્યા.

ગંગનાની ઉત્તરતાં જ પૂરુષશ્રીએ તેમની સત્ત્વાલીસ વર્ષ પહેલાંની ગંગનાનીની મુલાકાત વિષે અમને જણાવ્યું-

‘અમે પ્રથમ વખત આ સ્થળે ઉત્તરકાશીથી ચાલતા આવેલા. સખત ઠંડી હતી. પગમાં ફોલ્લા પડી ગયા હતા. તમાં સખત દુખાવો થતો હતો. મસોડાં બધાં કૂલી ગયેલાં અને શરીર સખત દૂખતું હતું, પૂરુણું હતું. તે વખતે આ સ્થળે મિલિટરીનો પણવ હતો. ચીન સાથે પુદ્જ ચાલતું હતું, કડક ચેકિંગ. અમારે ગંગોત્રી જવું હતું પણ મિલિટરીવાળાએ ચોખાની ના પાડી દીધી. અહીં કોઈ જાતની સગવડ નહીં. રાત પણ મિલિટરીવાળા જોડે તેમના તંબુમાં ગાળવી પડેલી. કંઈના કારણે ધાબળા પણ મિલિટરીવાળાના ઓઢેલા. બીજે દિવસે અમે અહીંથી ચાલતા ચાલતા ઉત્તરકાશી પાછા જવા નીકળેલા.’

આમ, પૂરુષશ્રી સાથે વાતો કરતા કરતા અમે ગરમ પાણીના કુડ જોવા ઉપર ગયા. ગંગનાનીમાં પહેલા જ્ઞાન કુડ હતા, પ્રબાકુડ, વાસકુડ અને ગીજો કુડ. હાલમાં માત્ર બે જ કુડ છે. એકમાં પુરુષો જ્ઞાન કરે છે અને બીજામાં શીઓ. આ ગરમ પાણીના કુડનો પણ મહિમા છે. તેમાં જ્ઞાન કરવાથી શરીરનો થાક ઉત્તરી જાય છે અને અમુક પ્રકારના રોગ મટી જાય છે. કુડના પાણીનો મહિમા સમજાવતાં પૂરુષશ્રીએ કહ્યું કે ‘આ કુડનું પાણી કાંઈ ચમત્કારિક નથી. પરંતુ આ પાણી જે પથ્થરોમાંથી આવતું હશે તે પથ્થરોમાંનાં અમુક બનીજ દવ્યો આ પાણીમાં બળતાં હશે, અને તેના કારણે તે શરીરના કેટલાક રોગો ઉપર અસરકારક થતું હશે.’ આટલું કંઈ પૂરુષશ્રી પોતાના પગ કુડના પાણીમાં બોળી થોડો સમય બેઠા અને થાક ઉત્તર્યા. કુડ ઉપરથી પાછા આવી અમે સૌ જીપમાં ગોઠવાયા અને ગંગોત્રી તરફ મ્યાંગ કર્યું.

સત્તામાં ધાસૂરા ગામે થોડો સમય રોકાઈ અમે ચાનાસ્તો કર્યો. ધાસૂરાથી નીકળી અમે ગંગોત્રી પહોંચ્યા. ત્યાં પહોંચીને કાળી કમલીવાળા આશ્રમની તથા બીજા બે-ત્રાણ આશ્રમની તપાસ કરી. ત્યાંની રૂમો પૂરુષશ્રી માટે અનુકૂળ ન લાગતાં ક્યાં મુક્કામ કરવો તે મશ્શ થઈ પડ્યો. અમે રૂમ શોખતા હતા તે દરમાન પૂરુષશ્રીના કહેવાથી અમે દરીસ્વામી શ્રી અચ્યુતાંદજના આશ્રમાં ગયા. દરીસ્વામીના આશ્રમાં રૂમો સારી હતી પરંતુ બધાની સગવડ થાય તેવી નહોતી. છેવટે તાત્કાલિક ગંગા હોટલમાં રોકાવાનું નક્કી કર્યું.

કરુણામૂર્તિ પૂરુણુદેવ પોતાના ભક્તો માટે કેટલી

હદ સુધી સહન કરે છે ! અમારા માટે તેઓ આશ્રમ છોડી લોજમાં ઉત્તર્થી, બે રૂમોમાં સામાન્ય ગૌઠવી દીધો, રાત્રે જમીપરવારી અમે સૌ આરામ કરવા લાગ્યા. પૂજ્યશ્રીને અમારી સાથે લોજમાં રહેવું પડેલું તેનો બધા ગુરુપ્રેમીઓને મનમાં ખૂબ કચવાઈ રહ્યો, કારણ કે અમને બધાને આશ્રમમાં રહેવાની ખૂબ ઈચ્છા હતી.

બીજે દિવસે સવારે પ્રાતઃકર્મથી પરવારી અમે ગંગામૈયાના મંદિરે દર્શન કરવા ગયા. પૂજ્યશ્રીએ મંદિરના વિવસ્થાપકને પૂર્ણિને ગંગાદાસ ફલાહારીભાભાના આશ્રમે જવાનો રસ્તો જાહી લીધો, તે બાઈએ પલાણ ચઢવામાં તકલીફ ન પડે તે માટે પૂજ્યશ્રીને એક લાકડી પણ આપો. અમે ગંગાજીના ડિનારે ડિનારે ફલાહારીભાભાના આશ્રમે જવા નીકળ્યા, વચ્ચે હંસગુજા આવી. ગુજામાં પૂછસાનંદજી સ્વામી રહેતા હતા, તેમની ઉમર આશરે એકસો પાંચ વર્ષની હતી. તેઓ ગાયત્રીના પરમ ઉપાસક હતા. તેમજો ગૌમુહ અને તપોવનમાં પણ સાખના કરી હતી. પૂજ્યશ્રી અને સ્વામી હંસાનંદજી એકબીજાને મળીને ખૂબ ખુશ હતા. બંને વચ્ચે આત્મીયતાસનભર વાતો થઈ, અમે પ્રશ્નાવંદના અને ગુરુઅસ્ક બોલ્યા. શ્રી હંસાનંદજીએ અમને હંલાયચી તથા લવિંગનો પ્રસાદ આપ્યો. હંસગુજામાં વણો સમય પસાર થઈ ગયો તેથી ફલાહારીભાભાના આશ્રમે જવાનો વિચાર મારી વાળી અમારી હોટલની બાજુમાં આવેલા કૃષ્ણાશ્રમમાં ગયા.

કૃષ્ણાશ્રમ, સ્વામી કૃષ્ણાશ્રમજીનો આશ્રમ છે. સ્વામીજીના દેવ થયા પછી આશ્રમનું સંચાલન તેમનાં પરમભક્ત પૂરુષ બગવતી સ્વરૂપ માતાજી સંભાળે છે. પૂજ્યશ્રી, માતાજીને મળ્યા. માતાજી પૂજ્યશ્રીને જોઈ ગદ્દગદિત થઈ ગયાં અને ત્યાં રહેવાનું આમન્તરણ આપ્યું. ડુક્કરમિકુએ રૂમો જોઈ. રૂમો સારી હતી. પૂજ્યશ્રીએ માતાજીને કહું કે ‘અમારી ઈચ્છા થશે તો કાલે બપોર પછી આવીશું.’

કૃષ્ણાશ્રમથી હોટલમાં પાછા આવતાં જ પૂજ્યશ્રીએ માતાજીની ગુરુભક્તિ વિષેની વાત કરતાં કહું કે -

‘કૃષ્ણાશ્રમવાળાં માતાજી તેમની યુવાનીમાં સમાજના નાસથી કટાળી આપવાત કરવા જતાં હતાં, પૂરુષોની કૃષ્ણાશ્રમજીએ તેમને બચાવી લીધાં અને પોતાના આશ્રમમાં રાખ્યાં. ત્યારબાદ માતાજી કૃષ્ણાશ્રમજીના શિષ્યા થઈ ગયાં. કૃષ્ણાશ્રમજીને એક રીત શિષ્યા સાથે કાયમ રહેતા જોઈ સાધુસમાજમાં ઘણો જીહાપોહ થયો. સ્વામીજી તથા માતાજીને ખૂબ ખખડાવ્યાં. માતાજીને જ્યારે સ્વામીજીથી અલગ થઈ જવા માટે ખૂબ દદુક કરવામાં આવ્યું ત્યારે તેમજો કહું કે ‘જો મને મારા પૂરુષેવથી દૂર જવાનું કહેવામાં આવશે કે પરાણે દૂર લઈ જવાશે તો હું ગંગાજીમાં દૂલ્લોને આપધાત કરીશ.’ અને સ્વામીજીને તે વિષે કહેવામાં આવે ત્યારે એ એમ કહે છે કે ‘મેં એને બોલાવી નહોતી, તે તેની જાતે આવી છે, તેથી હું તેને કાઢી ના શકું.’ ગુરુ-શિષ્યા વચ્ચેનો કેવો અદ્ભૂત પ્રેમ ! ત્યારથી માતાજી આ જ આશ્રમમાં રહે છે !’

હોટલેથી અમે યોગનિકેતન આશ્રમમાં ગયા. ત્યાંના સ્વામી ચૈતન્યજીએ પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. પૂજ્યશ્રીએ તેમને પૂજ્યથું કે અહીં યોગનું શિક્ષણ આપવામાં આવે છે ? તો સ્વામીજીએ જાણાયું - ‘ના, અહીં યોગનું શિક્ષણ તો આપવામાં નથી આવતું, પરંતુ જો જોઈ સાધક યોગસાધના માટે આવે તો તેને સગવડ આપવામાં આવે છે.’ આરું કાઢી સ્વામીજીએ અમને સાધકોની રૂમો બતાવી. ત્યારબાદ સ્વામીજી અમને આશ્રમના પાછણના ભાગમાં આવેલ સૂર્યકુંડ જોવા લઈ ગયા. અહીં ગંગામૈયા ધોખરૂપે વહે છે. સૂર્યકુંડનું કુદરતી સોંદર્ય અવર્ણનીય હતું. સ્વામીજી પસેશી ગૌરીકુંડ તથા દંડીસ્વામી અચ્યુતાનંદજીના આશ્રમે જવાનો રસ્તો પજ જાહી લીધો.

અમે બધા સૂર્યકુંડ પાસે ઊભા રહી ગંગાજીની અગાધ જળરણિને ધોખરૂપે પડતી નિછળી રદ્દી હતા.

સૂર્યદેવ પશ્ચિમ દિશા બાજુ ઢળતા જતા હતા. તેમનાં સૌનેરો ડિરણો ગંગાજી ઉપર પડતાં હતાં. સફેદ દૂધ જેવું પાણી સૂર્યપ્રકાશમાં ચમકતું હતું. ત્યાં જ પૂજયશ્રીએ અમને મેધયનુષ્ઠ બતાયું. અમે સૌ સમરંગી પાણી જોઈ પુલકિત થઈ ઊઠા. ધોયમાંથી ઊડતાં જલશીકરો અમારા શરીર ઉપર પડતાં હતા. તેથી અમે કંડી સાથે રોમાંચ અનુભવતા હતા.

સૂર્યકુંડનું અનુપમ સૌદર્ય માણી અમે ગૌરીકુંડ તરફ જવા નીકળ્યા. આગળ ચાલતાં બે રસ્તા પડતા હતા. ક્યા રસ્તે જવું તે વિચારતા હતા ત્યાં એક સ્વામીજી ખલ્યા. ગૌરીકુંડ જવાના રસ્તા વિષે તેમને પૂછતાં તેઓએ કહું ‘મારે પણ એ તરફ જ જવું છે, મારી સાથે ચાલો.’ પૂજયશ્રીએ તરત કહું ‘પ્રભુ પણ કેટલી મહેર કરે છે!? આપણને જરાય તકલીફ પડવા હેતા નથી. ઓમ્નાનારાયણ આપણી સાથે ને સાથે જ છે.’ રસ્તામાં સ્વામીજીએ અમને પર્વતની હારમાણા વચ્ચે ગંગાજીનો ધોય બતાવ્યો. અહીં ગંગાજી બે હથણી હથેળી બેગી કરી ખોબામાંથી ધોધરૂપે પડતાં હોય તેમ બે મોટા પછાડેની વચ્ચેથી પડે છે. નીચે શિવલિંગ જેવો આકાર છે. જાણો ગંગાજી શિવલિંગ ઉપર જલાભિપેક કરે છે. આપું દશ્ય કુદરતી રીતે ગોઠવાઈ ગયું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે પાંડવોએ અહીં પજ કર્યો હતો અને શિવલિંગ ઉપર અભિપેક કર્યો હતો. ત્યાંથી અમે આગળ વધતા હતા ત્યાં એક ટેકરી ઉપર કુટીર દેખાઈ. અમે વિચારતા હતા કે પેલી કુટીર કોણી હશે? ત્યાં જ બે યુવાન ભાઈઓ કે જે સાધક જેવા લાગતા હતા તે ત્યાંથી મસાર થતા હતા. પૂજયશ્રીએ તેમને નારાયણ કર્યા. તેમણે પજ પ્રમાણ કર્યા. તેમને પૂછતાં અભર પડી કે પેલી કુટીર સ્વામી ભૌલાનંદજીની છે. અમે સૌ યુવાન સાખડો સાથે સ્વામી ભૌલાનંદજીની કુટીર તરફ ગયા. કુટીર પહોંચ્યા એટલે સ્વામીજીએ પૂજયશ્રીનું સ્વાગત કર્યું તથા અમને સૌને બેસવા માટે આસન આપ્યું.

સત્સંગની શરૂઆત થતાં જ સ્વામીજીએ પૂજયશ્રીને પૂછ્યું કે ‘આપ વ્યક્તિ કો ઉત્ત્રતિ મેં માનતે હે કિ સમાજ કી ઉત્ત્રતિ મેં?’ પૂજયશ્રીએ જવાબમાં કહું કે ‘બંને અગત્યનાં છે. માનવી પોતે તપ કરી પોતાની ઉત્ત્રતિ કરે તો પણ સમાજની ઉત્ત્રતિ થાય છે અને કોઈ વ્યક્તિ સમાજની ઉત્ત્રતિ અર્થ પોતાનું જીવન સમર્પણ કરે તો તે પણ યોગ્ય જ છે.’ યોગની ચર્ચા થઈ ત્યારે પૂજયશ્રીએ કહું ‘નેતિ નેતિ. મેં યોગલિંગુ હું મેં આપ જૈસે સંતોસે કુછ પાને આયા હું. મેરી જોલી બરસે આયા હું. સ્વયં અછાંગ યોગમાં સર્વજ્ઞ હોવા છતાં પૂજયશ્રીનો આવો વિવેકપૂર્ણ જવાબ સાંચળી અમે પૂજયશ્રીની નિર્મણતાને મનોમન વંદી રહ્યા.

સ્વામીજીની કુટીરેથી નીકળી અમે ગૌરીકુંડ થઈને અચ્યુતાનંદજીના આશ્રમે આવ્યા. તેઓ મલ્યા નહીં એટલે પાછા વળી નીકળ્યા. ગંગામૈયાના મંદિરે આવી આરતીનો લાભ લીધો. ત્યાંથી અમારી હોટલે આવી, પ્રાણવંદના ગાઈને સૂર્ય ગયા.

તા. ૧૬-૫-૮૦ના દિવસે પૂજયશ્રીએ બધાને વહેલા ઉઠાડી દીધા. પ્રાતઃકર્મથી પરવારી અમે ગંગાદાસ ફ્લાલારીબાબાની કુટીરે જવા નીકળ્યા. તે લગ્ભગ બે કિ.મી. દૂર હતી. પૂજયશ્રીનો ખાસ આગ્રહ હતો કે ‘અહીં ગંગોત્રીમાં આપણે વધુ ને વધુ સંતોસે મળવું છે.’ અને એટલે જ જ્યારે અમે રસ્તામાં આવતી લક્ષ્મણ કુટીરની વાત કરવાનું ભૂલી ગયા એટલે તેઓએ તરત ટકોર કરી - ‘માઈ, જીવનમાં બીજું કાંઈ ના કરો અને માત્ર સંતોસના દર્શન કરશો ને તો પજ સારું છે. અહીં શેના માટે આવ્યા છીએ? આપણે ઋષિકેશથી ઉત્તરકાશી, ત્યાંથી ગંગોત્રી અને ગંગોત્રીથી ગૌમુખ તરફ ઊર્ધ્વગમન કરી રહ્યા છીએ. તે જ પ્રમાણે મનુષ્યે જીવનમાં વીર્યનું ઊર્ધ્વગમન કરી, તેનું ઓજમાં રૂપાંતર કરતાં શીખવાનું છે. સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે.’

પૂજયશ્રીની તાત્ત્વિક વાતો સાંભળતા સાંભળતા અમે ગંગાદાસ કલાહારીભાબાની કુટીરે પહોંચા. ભાબા બે સંતો સાથે રાજકીય ચર્ચા કરી રહ્યા હતા. પૂજયશ્રીને જોતાં જ આવકાર આપીને નમોનારાયણ કર્યા. ભાબા ગંગાદાસજી લગભગ સાડનીસ વર્ષથી અહીં ગંગોત્રીમાં જ રહે છે, નીચે ઊર્તર્યા જ નથી. તેમણે હાર્મોનિયમની સંગત સાથે ભગવાન શ્રીરામની સ્તુતિ કરતું એક ભજન ગાયું. અમે સૌ ભજન સાંભળીને ભાવવિભોર થઈ ગયા. ત્યારબાદ ભાબાની અનુમતિ લઈ અમે મૃષાવવંદના અને ગુરુઆટક ગાયાં, ગાયત્રીમંત્રનો જાપ કર્યા. ભાબાજી પણ અમારી સાથે એકતાલ થઈ ગાયત્રીમંત્રનો જાપ કરતા હતા. જાપ પૂરા થયા એટલે ભાબાના સેવકે અમને પ્રસાદ આપ્યો. પ્રસાદ લઈ અમે નીકળતા હતા તે સમયે ભાબાને પૂજયશ્રીને કહ્યું ‘બીજા ભક્તોને અહીં મોકલાશે.’ જવાબમાં પૂજયશ્રીએ કહ્યું ‘તમે કહો એટલે અમે ભક્તોને મોકલીશું એમ નહીં, તમે ના કહેશો તો પણ મોકલીશું.’ આટલું કહી પૂજયશ્રી અમારી સાથે બહાર નીકળ્યા.

પૂજયશ્રી થોડે આગળ જઈ થોભ્યા અને અમને કહ્યું કે ‘સંત સાડનીસ વર્ષથી અહીં રહે છે, નીચે ઊર્તર્યા જ નથી પણ હજુ તેમનામાંથી માયા ગઈ નથી. હજુ પણ તેઓ લોકોને કહી રહ્યા છે કે બીજા ભક્તોને મોકલાશે! તો પછી અહીં રહેવાનો અર્થ શો ?’

ગંગાદાસભાબાની કુટીરેથી પાછા વળતાં અમે લક્ષ્મણ કુટીરે ગયા. ત્યાંના સ્વામી શ્રી સત્યાનંદજીએ પૂજયશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. પૂજયશ્રીને વ્યાઘરચર્મ ઉપર બેસાડીને કહ્યું ‘ધહ આશ્રમ આપકે લિએ હમેશા ખૂલા હૈ, આપ કબી લી યણાં આકર ઠહર સકતો હૈ. આપ કયા લેંગો, ચાય, કોકી યા દૂધ?’ પૂજયશ્રીએ કહ્યું ‘અત્યારે તો અમારે ઉતાવળ છે. આપ દૂધ રાખી મુક્ખો, જરૂર હશે ત્યારે મંગાવી લઈશું.’ લક્ષ્મણ કુટીરેથી નીકળી અમે અમારી હોટલ ઉપર પાછા આવ્યા. બપોરના સાડા બાર થઈ ગયા

હતા. પૂજયશ્રીના આદેશ મુજબ અમારે રૂમ ખાલી કરીને કૃષ્ણાશ્રમમાં રહેવા જવાનું હતું. પૂજયશ્રી ઉતાવળ કરતા હતા એટલે અમે કહ્યું ‘બાપુ, હોટલવાળાભાઈએ કહ્યું છે કે બે કલાક સુધી વાંધો નહીં.’ પૂજયશ્રીએ તરત કહ્યું કે ‘ભલે તેમણે તેમ કહ્યું પરંતુ આપણે એક કલાકમાં રૂમ ખાલી કરીને આપી દઈએ તેમાં જ આપણી માનવતા છે.’ આમ, પૂજયશ્રી દરેક પ્રસંગે અમને કંઈક ને કંઈક શિખવાડતા જતા હતા. અમારા હુર્ગુણો તરફ ધ્યાન દોરતા જતા હતા અને અમને સુધારવાનો પ્રયત્ન કરતા હતા. અમે તરત જ અમારા રૂમ ખાલી કરી દીધા અને સામાન સાથે કૃષ્ણાશ્રમમાં પહોંચ્યા.

કૃષ્ણાશ્રમમાં પહોંચતાં જ બધા ખૂલ આનંદમાં આવી ગયા. ત્યાંનું વાતાવરણ ખૂલ પવિત્ર હતું આશ્રમમાં અમે જાતે બોજન બનાવ્યું. સૌએ પ્રસાદ લીધો. પ્રસાદ બાદ આરામ કરી સાંજે ફરવા નીકળ્યા. ગંગામૈયાની આરતી કરી પાછા આવી ગયા. રાત્રે મૃષાવવંદના ગાઈ અમે સહૃદ સૂર્ય ગયા.

તા. ૧૭-૫-૮૦ના રોજ સવારે પ્રાતઃકર્મથી પરવારી અમે સૌ ગંગાજીના સામા ડિનારે વસતા સંતોનાં દર્શન કરવા નીકળ્યા. અમે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે પૂજયશ્રીની બેગ, પુસ્તકોનો બગલથેલો, હિન્દી-અંગ્રેજી સાહિત્યનો એક બગલથેલો, એક કેમરો, ટેપરેકોર્ડરનો એક થેલો, એક વોટરબેગ, ઉપરાંત પૂજયશ્રીનું આસન, પ્રાલો, નેપાંકન વગેરે બધું સાથે લઈને જ નીકળતા. ગંગાજીના સામે ડિનારે જઈ પ્રથમ મહામંદલેશ્વર શ્રી સીતારામદાસજી મૌની મહારાજના આશ્રમમાં ગયા. ત્યાં તેમના શિષ્ય કોશલયાપસાદજી હાજર હતા. આશ્રમ ઘણો વિશાળ હતો. અમે તેમને પૂજયું કે આપા સંધ્યાસાથે અહીં આવીએ તો આવી શકાય? તેમણે કહ્યું કે જરૂરથી આવી શકો છો, શક્ય હશે તે સગવડ આપીશું. આશ્રમમાં બીજા ચાર સંતો પણ રહેતા હતા. તે બધાને પૂજયશ્રીએ બેટ

આપો આશમેથી નીકળી થોડે દૂર આવેલ આચાર્ય કુટીર તરફ ગયા. ત્યાંના સ્વામીશ્રી લક્ષ્મીપ્રમાણાર્થજી હતા. તેઓ શ્રી રામાનુજાચાર્યના શિષ્ય હતા. પૂજ્યશ્રીએ તેમની સાથે થોડી વાતો કરી, અમે ત્યાં બેસી ગુરુઆસ્ક ગાયું, ગાયત્રીમંત્ર તથા હનુમાનજીના સંકટમોચનના મંત્રની ખૂન બોલાવી. પૂજ્યશ્રીએ સ્વામીજીને પુસ્તકો તથા લેટ્રપસાઈ આપો અને અમે ત્યાંથી આગળ વધ્યા.

અમે જે વિસ્તારમાં ફરી રહ્યા હતા તે વિસ્તાર ગંગાભાગ વિસ્તાર હતો. અમે ચાલતા ચાલતા બ્રહ્મચારી શ્રી હરિયેતનદાસજીની કુટીર, કે જે પર્વતની ગુફામાં બનાવેલી છે, ત્યાં ગયા. હરિયેતનદાસજીએ પૂજ્યશ્રીને જ્યનારાયણ કર્યા. તેઓએ પૂજ્યશ્રીને કહ્યું કે તેમની કુટીર તેમજ અન્ય બે સંતોની કુટીર બરફમાં દટાઈ ગઈ હતી. તે સંતોની કુટીર ખલાસ થઈ ગઈ. તેઓ છ માસ અહીં રહે છે અને છ માસ કનાખલમાં રહે છે. શ્રી હરિયેતનદાસજીએ હિમાલયમાં થતી થોડી જડીબુડી વિષે જણાયું કે ‘અહીં, થોડેક દૂર મમરી અને મમારી નામની વનસ્પતિ થાય છે, જેમાં મમરી નર છે અને મમારી માદા છે. સૂર્યપ્રકાશમાં તે ઓળખી શકતી નથી. પરંતુ રાત્રે ઓળખી શકાય છે. નર વનસ્પતિ રાત્રે ચમકે છે. તેને ચુંટી લેવાની હોય છે. અંખોની રેશની માટે આ વનસ્પતિ ઘણી કામની છે. આ ઉપરાંત અહીં બ્રહ્મકમળ નામની વનસ્પતિ થાય છે. તેને તોડીએ ત્યારે તોડનારને ધેનની અસર થાય છે. તે ખૂબ પવિત્ર મનાય છે. બ્રહ્મકમળનો ઉપરોગ પૂજમાં થાય છે.’ અમને તેઓની કુટીરમાં એક સુકાયેલું બ્રહ્મકળ જોવા મળ્યું. હરિયેતનદાસજીની કુટીરેથી નીકળી અમે પૂર્ણનાદાસજીની કુટીર તરફ જવા નીકળ્યા.

જમનાદાસજીની કુટીરે જવાનો રસ્તો થોડો વિકટ હતો. તે તરફના પણીઓ ઉપર બરફ છવાપેલો હતો. અમે બરફ ઉપર ખૂબ સાવચેતીથી ચાલતા હતા. પ્રથમ વખત બરફ ઉપર ચાલતા હોવાથી અમને થોડું નવું નવું લાગતું

હતું. મનમાં ગંગારાટ પણ હતો કે ક્યાંક લપસી ન જવાય. અમે વાતો કરતા કરતાં આગળ વધી રહ્યા હતા. ત્યાં જ સામેથી જમનાદાસજીને આવતા જોયા. તેઓએ નશ્શક આવીને પૂજ્યશ્રીને નમોનારાયણ કર્યા. તેઓએ તેમની પાસેના ડેલચામાંથી અમને ગરમાગરમ શીરાનો પ્રસાદ આપ્યો. પ્રસાદ લઈ અમે તેમને પૂછીને બ્રહ્મચારી જિરીશની ગુફા તરફ ગયા. તે ગુફાના રસ્તે પણ બરફ છવાપેલો હતો. અમે તેમની કુટીરે પહોંચ્યા. કુટીરની આસપાસ ખૂબ બરફ હતો. પૂજ્યશ્રીએ તેમને નારાયણ કર્યા. પૂજ્યશ્રીએ પૂછ્યું ‘અત્યારે આટલો બરફ છે તો શીતકાળમાં તો આ ગુફા બરફથી ઢંકાઈ જતી હોય? ત્યારે આપ શું કરો છો?’ ડૉ. જિરીશે જડાયું કે રોજેરોજ રસ્તા ઉપરનો બરફ સાફ કરવો પડે ત્યારે બહાર નીકળાય.

ડૉ. જિરીશે પૂજ્યશ્રીને જડાયું કે જાડના વિકાસ અથે અહીં આવેલા સરકારી ઓફિસરો અહીં વસેલા સંતોની કુટીરો રહેવા દેતા નથી. જાડનાં લાકડાં પણ લેવા દેતા નથી. પરંતુ કુદરત હેમેશાં સંતોની પણ હોય છે. આ વર્ષ કુદરતે એવું તોશન સજ્જું કે ખૂબ જાડ તૂટી પડ્યાં અને સંતોને દસથી પંદર વર્ષ ચાલે તેટલાં લાકડાં લેગાં થઈ ગયાં. આ વર્ષ હિમપ્રાપતમાં બરફનાં જે ગ્લેસિયરો તૂટી પડ્યાં હતાં તેનાથી ગંગાજીનો પ્રવાહ છત્તીસ કલાક અટકી ગયેલો.

ડૉ. જિરીશે પૂજ્યશ્રી સાથે સત્તસંગ કરતાં કહ્યું - “ચંદ્રનકા લકડા કટનેસે સુગંધ નિકલતી હૈ. આભાકા યહી રૂપ હૈ. જીવકો ઉસકા સ્પર્શ હોને સે બ્રહ્મલીન હો જાતે હૈ. અસંતૃપ્ત મનમે સંકલ્પ-વિકલ્પ આતે હૈ. આનંદ કે બીચ યહી બાધા હૈ. ગંગોત્રીમે એક સાલ સિંહ આપ રહો, બોજન કરો ઔર શાંતિસે સો જાઓ કિર ભી મન શાંત હો જાતા હૈ, આભાર્દીન હો જાતા હૈ. પહી યદાં કી વિશેષતા હૈ. અદેત ચર્ચાકા વિષય નહીં હૈ, દેત ચર્ચાકા વિષય હૈ, યાં ભગવાન હૈ તો પૂછો કયો નહીં મિલતા હૈ? જગકુછ

વાસુદેવમય હિંભાઈ પડે તથ આત્મસાક્ષાત્કાર હોતા હૈ. યોગ ક્યા હૈ? યોગશિચત્તવૃત્તિનિરોધ: ચિત્તવૃત્તિઓકા નિરોધ યોગ હૈ. મનુષ્ય અપની પૂરી આયુમે બહોત સારા અન્ન જા જાતા હૈ કિર લી ઉસકી જિદ્દાસે સ્વાદ નહીં હટતા. વૃત્તિયોકા લી એસા હી હૈ. આસન, પ્રાણાયામ કરનેસે જ્યાદા શક્તિ આત્મા હૈ લેઝિન લોગ ઉસે ભૌતિકતા "પ્રાપ્ત કરનેમે ખર્ચ કરતે હૈ." પૂજ્યશ્રીએ જ્યારે ડૉ. જિરોશને કહું કે અમે પણ પાતંજલ યોગદર્શનના

સમાધિપાદ અને સાધનપાદ ઉપર બે ભાખો લાખાં છે અને આણંગ યોગનો અભ્યાસ કર્યો છે, ત્યારે ડૉ. જિરોશ ખૂબ અભિવિત થઈ ગયા અને પૂજ્યશ્રીને તેમણે લળીલળીને વંદન કર્યા.

વર્સાદ પંડુ પંડુ થઈ રહ્યો હતો તેથી અમે જડપદી અમારા નિવાસ તરફ પાછા વળ્યા. કૃષ્ણાશ્રમ અઠી અમે રસોઈ તૈયાર કરી જમી લીધું. બીજે હિવસે ગોમુખ જવાનું હોવાથી વહેલા વહેલા સૂઈ ગયા.

## ... તો અંતમુખ શવું પડે

(ઓમ્નિ ગુરુદેવ જ્યંતીનો પ્રોરણાદાચી અદેવાલ)

સંકલન - શાશ્વીકાંત પટેલ

ઓમ્પરિવારના ઉપકરે તા. ૮-૧૧-૧૯૮૮ને મંગળવારના રોજ, ગુરુપાદપંક શ્રી પંકજભાઈ શાહના દેર ઓમ્નિ ગુરુદેવ જ્યંતીનો કાર્યક્રમ યોજાયો. તે દિવસે આસો વદ દશમ હતી. તિથિ મુજબ તે દિવસ પ.પૂ. ગુરુદેવ શ્રી યોગબિસુલ્લાનો જન્મદિવસ છે જેને ઓમ્પરિવારના ગુરુપૂજનો દર વર્ષે ધામધૂમથી ઊજવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પંકજભાઈ શાહના દેર આ કાર્યક્રમ ઊજવાયો. બપોરે ચાર વાગ્યે કાર્યક્રમની શરૂઆત પ્રાણવવંદનાના ગાન સાથે થઈ. ત્યારબાદ ઉપસ્થિત સૌ ગુરુભાઈબહેનોએ સ્વાધ્યાયની શરૂઆત કરી. સૌ ભક્તિભાવપૂર્વક સ્વાધ્યાયનું ગાન કરી રહાં હતાં તે દરમિયાન જ પૂજ્યશ્રી પણાર્થ અને પોતાનું આસન ઘેલાય કર્યું. સ્વાધ્યાય બાદ શ્રી નેયધભાઈએ પૂજ્યશ્રીએ રચેલાં તથપદી બજન-ગરબા જાયાં. ત્યારબાદ પૂજ્યશ્રીએ હાલમાં રચેલ ગરબો-સોહે સોહે જાય, માણ તારો ગરબો સોહે જાય - મુમુક્ષાબહેને જાયો. ગરબાની એક એક લીટીમાં શરીરરૂપી ગરબાનું પૂજ્યશ્રીએ ખૂબ તાત્ત્વિક રીતે વર્ણન કર્યું છે. ધ્યાનપૂર્વક ગાઈએ તો ગાતાં ગાતાં જ

સમાધિસ્થ થઈ જવાય એવો સુંદર આ ગરબો છે! ગરબો ગવાઈ રહ્યો એટલે ગુરુદેવની આરતી શરૂ થઈ. પૂજ્યશ્રીએ સ્વહસે ઓમ્પરમાત્માની આરતી ઉતારી.

હવે ગુરુપૂજનનો કાર્યક્રમ હતો. પૂજ્યશ્રી એવો ખાસ આગ્રહ રાખે છે કે ગુરુપૂજન ફક્ત સ્થળ રીતે જ ન કરવું. કોઈ સત્કાર્યનો સંકલ્પ કરીને સૂક્મ રીતે, તાત્ત્વિક રીતે ગુરુપૂજન કરવું. થોડો વિચાર કરીને પૂજ્યશ્રીએ કહું -

"જેમની ગુરુપૂજન કરવાની ઈચ્છા હોય તેમણે આજે એક સંકલ્પ કરવાનો છે. ગુરુપૂજન કરવા ઈચ્છતાં બાઈબહેનોએ 'સોહમુ' મંત્રનું લેખન કરવાનું છે. એક નોટબુકમાં વ્યવસ્થિત રીતે સોહમુ મંત્ર લખવાનો છે. તા. ૨૬-૧૨-૯૮ના ધજારોહણ અને બિસુબોધોત્સવના કાર્યક્રમ સુધીમાં દરેકે સંકલ્પ કરેલા મંત્રોનું લેખન કરી તે નોટબુક ધજારોહણના કાર્યક્રમમાં લાવવાની છે. ડૉ. સદ્ગુરુસર્માર્પણબિસુલ્લા તમારા સૌની પાસે આવે છે. થોડો સમય વિચાર કરી તમે સૌએ નક્કી કરેલા મંત્રોની સંખ્યા લાગાવજો."

ત્યારબાદ પૂજ્યશ્રીએ "સોહમુ" મંત્રની મહત્ત્વ

समाधारतां दृक्मां जग्याव्युं के -

“तंहुरस्त मनुष्य चोवीस कलाकमां लगभग २१६०० वर्षत शासो शासनी हिया करे छे. ते ज्यारे शास ले त्यारे ‘सो’ अने उच्छ्रवास भाषार कडे त्यारे ‘हम्’ ध्यनि नीको छे. आम दरेक मनुष्य जाग्येअजाग्ये २१६०० वर्षत ‘सोहम्’ मंत्रना जाप करे छे. आने अजपाजाप कहेवामां आवे छे. शास्त्रोमां पश्च आ भंत्र विषे घाणु बधु लभायु छे. तमे सौ ज्यारे ‘सोहम्’ मंत्र लभता हो त्यारे तमारी भावना केवी होवी जोहीअे ? तमे ज्यारे भंत्र लभता हो रे ओवी भावना जगाववानी छे के जाणे तमे गुरुपूजन करी रह्या छो, गुरुओना गुरु ओभगुरुनु पूजन करी रह्या छो. आवी भावना साथे मंत्रलेखन करवानु छे.”

पूज्यश्रीनी आटली वात सांबण्या बाट डॉक्टरभिक्षुलु दरेक भाईबहेन पासे जई तेमनुं नाम अने तेमझो नक्की करेली संभ्या लभता गया. ते दरभ्यान पूज्यश्रीअे घाणां भाईबहेनोने वस्त्रनी-शावनी भेटप्रसादी आपी. डॉक्टरभिक्षुलुअे सौनां नाम लणी मंत्रोनी संभ्यानो सरवाणो कर्ही अने पूज्यश्रीने जग्याव्युं के लगभग पचीस लाख ‘सोहम्’ मंत्रनुं लेखन पिस्तालीस टिवसमां थरे. आ शीते तात्पिक गुरुपूजननो कार्यक्रम पूरो थयो.

त्यारबाट पूज्यश्रीअे ग्रो. आर.डी. देसाईने बे शब्द भोलवानुं कह्यु, देसाई साहेबे सभाने संबोधतां कह्युं के -

“प. पू. गुरुदेवे आपक्षा उपर कृपा करीने पातंजल गर्दर्शननो समाधिपाद अने साधनापाद उपर प्रवचन करीने आपक्षने ‘मुक्ता’ अने ‘शांता’ नामनां बे अमूल्य पुस्तको आप्यां. पूज्यश्रीने आपको विनंती करीअे के पोगर्दर्शनां त्यार पछीनां बे पाठ विभूतिपाद अने डैवल्यपाद उपर भाष्य लभवानी कृपा करे.”

देसाई साहेबनी आटली वात सांबणी पूज्यश्रीअे जग्याव्युं के -

“अे बंने पाठ उपरनां पुस्तकोनी चारे भाजुथी ज्ञानदस्त मांगडी थई रही छे परंतु हवे अमने नथी

लागतुं के ए पुस्तको प्रगट थई शके! आ जे बे पुस्तको ‘मुक्ता’ अने ‘शांता’ प्रगट थयांछे अना माटे अमे केतला बधा अंतर्मुख थयेला हता! भैउरावपुरामां आवेल ‘योग साधना कुटीर’मां महिनाओ सुधी बाराण्यां बंध करीने चिंतन-मनन करता रहेता. ज्यारे हालमां तो भक्तोना आग्रहने वश थर्ने एक एक गामभां चार-चार सभाओ करीअे छाइ. आवी परिस्थितिमां हवे विभूतिपाद अने डैवल्यपाद उपर लभवानुं क्यांधी राक्य बने ? अतिरथ अंतर्मुख होहीअे तो ज ए राक्य बने. अने हवे तेवा अंतर्मुख थवानो मोक्षे भगे तेम छे नही. जो ए लभवा माटे भारे अंतर्मुख थवुं होय तो भूगर्भमां चाल्या जवुं पडे. अने हु भूगर्भमां चाल्यो जाउ ए पश्च तमने सौने मंजूर नथी.

“अमारे योग उपर जे कांઈ कहेवानुं छे ते अमारां बे पुस्तक ‘मुक्ता’ अने ‘शांता’ द्वारा कही ज दीधिलुं छे. वणी विभूतिपाद ए कांઈ प्रवचननो विषय नथी, अनुभववानो विषय छे.

“प्रथम बे पाठ समाधिपाद अने साधनपाद. समाधिपादमां बधी समाधिओनुं वर्णन आवे छे अने तेने प्राप्त करवा माटे साधना कर्ही रीते करवी तेनु वर्णन साधनपादमां आवे छे. अमेरिकामां पश्च आ पुस्तकोनी खूब ज मांग छे. अमेरिकामां डॉ. मनुभाई पंडिताने मणवानुं थयुं हतुं त्यारे तेओअे कह्युं के गुरुज्ञ, मे आपनु पुस्तक ‘मुक्ता’ वांच्यु त्यारथी आपने गुरुज्ञ मानी लीधा छे. तो, अमारुं कहेवानुं ए छे के आ बंने पुस्तकोमां अमे घाणु बधुं कही दीधुं छे. त्रीजो पाठ विभूतिपाद छे अने चोथो डैवल्यपाद, डैवल्य एट्ले डेवण, पछी एकला थई जवानुं छे. “सर्व धर्मान् परित्याज्य मामेकं सर्वं प्रजा” अने “स्वधर्मं निधनं श्रेयं परधर्मो भयावह.” तो आ जे श्लोक छे ए ज डैवल्यपाद, ए ज डैवल्य-सोहम्, ए ज स्वधर्मं. स्वधर्ममां - पोताना धर्ममां मृत्यु आवे तो ए श्रेयस्कर छे, परंतु पारको धर्म भयावह छे. हु बीजुं कांઈ

જ નથી પરંતુ માત્ર આત્મા છું એવી સમજણ દર થઈ જાય તે સ્વર્ધમ છે અને હું માતા છું, બાઈ છું, પુત્ર છું, આ છું, તે છું એવી સમજણ તે છે પરખર્મ.

“ઉપરોક્ત બે શ્લોકો ઉપર અમેરિકામાં પણ ખૂબ જ બોલવાનું થયેલું. આજના કાર્યક્રમમાં હમણાં જ અંશાતભિકૃત્યાએ (દેસાઈ સાહેબો) વિભૂતિપાદ અને કેવલ્યપાદનાં બાધ્ય માટે જે કોઈ કલું, તેવી માંગણી ચારે બાજુથી થઈ રહી છે.

“થોડાં વર્ષો પહેલાં માઉન્ટઆબુમાં લાલમંદિરના મહંત શ્રી અભેદાનંદજીને મળવાનું થયેલું. તેમની સાથે ખૂબ જ આત્મીયતા થઈ ગયેલી. લગ્નબગ બ્યાંશી વર્ષની તેમની ઉમર, ખૂબ જ નિર્ભળ, પરિત્ર વાજીતત્વ. તેઓ ડબલ ગ્રેજ્યુએટ થયેલા. તેમનો આશ્રમ પણ ઘણો મોટો હતો. અમે લાલમંદિરમાં થોડો સમય રહેલા ત્યારની આ વાત છે. અભેદાનંદજીએ પણ આ બે પાદ વિષે બાધ્ય લખવા જબરજસ્ત આગ્રહ કરેલો. “મુક્તા” તથા “શાંતા” વાંચ્યા બાદ તેઓ અમને કહેતા કે “આજ સુધી ચોગદર્શન ઉપર હું એકસો બાધ્ય જોઈ ગયો પણ આપનું જે પ્રકારનું બાધ્ય છે એવું જવલે જ જોવામાં આવે છે. આપની આવી વિશિષ્ટતાના કારણો જ વિભૂતિપાદ અને કેવલ્યપાદ ઉપર આપનું ચિંતન-મનન શું છે એ મારે જાણવું છે.” અમે તેમને જાણવ્યું કે અમારો સ્વાનુભવ જો એ બાધ્યોમાં રજૂ કરીએ તો જ એ વિશિષ્ટ બાધ્ય બને, પરંતુ ફક્ત વિદ્વતાની રીતે બાધ્ય રજૂ કરવાનું હોય તો તો અનેકમાં એકનો વધારો થાય.

“આ સાથે બીજી પણ એક પ્રેરણાદારી વાત છે. એપ્રિલ-દિનમાં વલસાડ મુકામે બે દિવસનો સ્વાધ્યાય-સત્સંગનો જહેર કાર્યક્રમ રાખેલો. ત્યાંના ગ્રોફેસર પ્રથમેશભાઈને આપણા ગ્રત્યે ખૂબ પ્રેમ અને આદરભાવ, કાર્યક્રમ માટે વલસાડ ગયા ત્યારે તેમણે એવો આગ્રહ કર્યો કે જહેર સત્સંગ બે કલાકનો નહીં પણ ત્રણ કલાકનો રાખીએ અને સવાર-સાંજ એમ બે વખત રાખીએ. આ

સાંબળી મેં તેમને હસતાં હસતાં કલું કે આવી રીતે પ્રવચનો કરવાં એ તો વિદ્વાનોનાં કામ છે, સંતોનાં કામ નથી. વિદ્વાનો માટે પ્રવચનનો સમય અને વિષય અગાઉથી જ નક્કી હોય છે. વળી વિદ્વાનો આપણાને સંભળાવવા માટે આવે છે. જ્યારે સંતોની વાત જુદી છે. સંતો માટે કોઈ વિષય નક્કી ના હોય કે કોઈ સમય પણ બાંધેલો ના હોય. વળી સંતોને સાંભળવા આપણો સંતો પાસે જવું પડે. પોપટને પિંજરામાં પૂરીને કહીએ કે તારે હવે મીહું મીહું બોલવાનું છે; તો એ બોલે? ના બોલે. જો એને સાંભળવો હોય તો તેને પિંજરામાં પૂરીને સાંભળી ના શકાય મુક્તપણે પોતાની મસ્તીમાં ઊડતો હોય અને ઊડતાં ઊડતાં બોલે તે સમયે સાંભળણું જોઈએ.

“અત્યારે તો અમારે ગામડાંમાં જવાનું બંધ થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે પરંતુ પહેલાં લાંબા સમય સુધી ગામડાંમાં રહેતા. તે વખતે શું નિયમ હતો તેની બબર ગામડાંનાં ભાઈબહેનોને છે, અમે સાંજે દીશાજંગલ જવા માટે જઈએ ત્યારે પણ સાથે પાંચ-પંદર માણસ હોય. પરમાત્માની પ્રેરણા થાય અને અંદરથી ઊભરો ચેડે ત્યારે અમે બોલવા માંડીએ. તે વખતે અમારી સાથે જે કોઈ હોય તેને સાંભળવાનો લાભ મળે. તો, મુખ્ય વાત એ છે કે ગુરુસંતોને જ્યારે પ્રેરણા થાય ત્યારે તે બોલેછે. તેમના માટે કોઈ સ્થળ, સમય કે વિષય નક્કી નથી હોતાં. આ વાતનું આપણે સૌએ ધ્યાન રાખવાનું છે, આ વાતનું ધ્યાન રાખીશું તો સૌને ગુરુસંતોની વાણીનો વધુમાં વધુ લાભ મળી શક અસ્તુ.

“પરમકૃપાળું પરમાત્માની કૃપાથી-પ્રેરણાથી આજે આ ઓમુગુરુદેવ જ્યંતી નિમિત્તે ખૂબ સત્સંગ કર્યો અને આધ્યાત્મિક આનંદ લીધો. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવો લાભ સૌને વારંવાર આપો.”

પૂજ્યશ્રીના ઉપરોક્ત પ્રવચન બાદ સૌ ગુરુભાઈબહેનોએ પ્રસાદ લીધો. ત્યાર બાદ કાર્યક્રમની પૂર્ણાદ્ધુતિ થઈ.

ओश्वर का बोधक (नाम) प्रणव/ओम् है।



( समाधिषाद के द्वारा का भावानुवाद )

- (२४) क्लेश, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है ऐसा पुरुषविशेष/चेतनविशेष ओश्वर है।
- (२५) ओश्वर संपूर्ण सर्वज्ञ है।
- (२६) ओश्वर पूर्वकाल के गुरुओं के भी गुरु है और काल की मर्यादा से (जन्म—मृत्यु से) पर है।
- (२७) ओश्वर का नाम प्रणव/ओम् है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
- (२९) चिन्तन सहित जप करने से अन्तरायों का अभाव और आत्मसाक्षात्कार होता है।

प्राप्तिक्रियान : ओम् परिवार, १/अ, फलियडनगर, नारणपुरा, अहमदाबाद-३८० ०९३।

### ● ट्रस्टना उद्देशो :-

- (१) सर्वव्यापक परम सूक्ष्म येतन तत्त्व के जेनुं नाम प्रणव (ओम्-ॐ) छे तेनी प्रतीति बहुजनसमाजने कराववा प्रयत्न करवो। (२) 'योग' नो प्रचार, प्रसार अने संशोधन करवा प्रयत्न करवो। (३) समाजनुं नैतिक धोरण ऊंचु लाववा भाटे आध्यात्मिक ज्ञाननो साहित्य द्वारा प्रचार अने प्रसार करवानो प्रयत्न करवो। (४) आ उपरांत 'बहुजनहिताय-बहुजनसुखाय' ने लगतां कार्यों जेवां के केणवणी, तथीबी सारवार वगेरे करवा भाटे प्रयत्न करवो।

## PRINTED BOOK

Registrar of News Papers of India under Regd. No. 48770/90

८३

To,

ગુરુદેવ શ્રી યોગભિક્ષુજી

આધિકન્યાપક તથા  
આધિકન્યાપક પડા. પુ.

ગુરુદેવ શ્રી યોગભિક્ષુજી

### PRINTED & PUBLISHED BY :-

Dr. S. S. Bhikshu for  
AUMGURU PREMSAMARPANDHYANBHIKSHUPARIVAR TRUST  
1/A, Palladnagar Society, Naranpura, Ahmedabad - 380 013.  
Printed at : Kunai Offset, Ondhav, Ahmedabad.  
Hon. Editor : Naishadh C. Vyas  
(Reg. No. E/4416 Date 11-5-81)  
I.T.E.U. 80-g (5) No.H.Q.-III 33-163/92-93 up to March 1995

### લખાજમ દર :-

વાર્ષિક સભ્ય (ભારતમાં)	રૂ. ૧૨-૦૦
આજીવન સભ્ય--	રૂ. ૨૫૦-૦૦
વાર્ષિક સભ્ય(પરદેશમાં)--	૧૨ ડોલર
આજીવન સભ્ય--	૨૫૦ ડોલર

### લખાજમ મોકલવાનું સ્થળ :-

- (1) ડૉ. સોમાભાઈ એ. પટેલ  
૧/અ, પલિયાનગર,  
સેન્ટ એવિયર્સ હાઇસ્કુલ રોડ,  
નારાણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
- (2) નૈષધભાઈ સી. વ્યાસ  
"સ્વાશ્રય"  
૩, ગંગાપર સોસાપટી, ચામબાગ પાછળ,  
મણીનગર, અમદાવાદ- ૩૮૦ ૦૦૮.

### સૂચના :-

- (1) લખાજમ એક દારુ અથવા મનીઓર્ડર દારુ  
"ઓ. એ. પ. ટ્રસ્ટ" ના નામે મોકલવું. સાથે  
આપનું પૂરું નામ, સરનામું શુદ્ધ અલરોમાં  
લખી મોકલવું.
- (2) જે સભ્યનાં રહેઠાણનાં સ્થળ બદલાયાં હોય  
તેમણે તેમના નવા રહેઠાણનું પૂરું સરનામું  
લખી મોકલવું જેથી વ્યવસ્થાપકોને અંક  
મોકલવામાં સરળતા રહે.
- (3) "રંતમના" ને લગતો પત્રવ્યવહાર નીચેના  
સરનામે કરવો.  
નૈષધભાઈ સી. વ્યાસ  
"સ્વાશ્રય"  
૩, ગંગાપર સોસાપટી, ચામબાગ પાછળ,  
મણીનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

૫. પુ. ગુરુદેવ શ્રી યોગભિક્ષુજી  
સાથેનાં સંસ્મરણાં તથા પ્રેરક  
પ્રસંગો આવકાર્ય છે.

Pin Code

--	--	--	--

દિનાં